

પ્રસાર ભારતી

સમાચાર વિભાગ, આકાશવાણી, ભુજ

Date : 18-04-2026

Day: Saturday

Evening : 6.25 to 6.30 pm

આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે.

PM : રાષ્ટ્રને સંબોધન :

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે સાડા આઠ વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. મહિલા અનામત સંબંધિત બંધારણ સુધારા ખરડો પસાર થવામાં નિષ્ફળ રહ્યાના એક દિવસ પછી પ્રધાનમંત્રી આ સંબોધન કરી રહ્યા છે. વિરોધ પક્ષોના સમર્થનના અભાવે મહિલા અનામત બિલ બે તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયું. પરિણામે, તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું. સીમાંકન દ્વારા મહિલાઓ માટે અનામત લાગુ કરતો પ્રસ્તાવિત કાયદો લોકસભામાં 21 કલાકની લાંબી ચર્ચા પછી પણ પસાર પસાર કરાવવામાં સરકાર નિષ્ફળ રહી હતી.

જખૌ - માછીમારી બોટ ડૂબી :

અબડાસા તાલુકાના જખૌ બંદરથી માછીમારી માટે નીકળેલી 'અલ સફીના' નામની બોટને કોરીકીક નજીક આવેલા સુગારબેટ પાસે અકસ્માત નડતાં તેણે જળસમાધિ લીધી હતી. સદનસીબે બોટમાં સવાર પાંચેય ખલાસીનો આબાદ બચાવ થયો છે.

પ્રાથમિક વિગતો મુજબ, ગઈકાલે વહેલી સવારે 'અલ સફીના' બોટ જખૌ બંદરથી માછીમારી કરવા દરિયામાં ગઈ હતી. સુગારબેટ નજીક અકસ્માતે બોટ ડૂબી જતા પાંચેય માછીમારોને આસપાસ માછીમારી કરી રહેલી અન્ય બોટોએ સમયસર બચાવી લીધા હતા.

જો કે, બોટ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ બોટ ઓખાની હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી :

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને હવે એક અઠવાડિયા જેટલો સમય બાકી છે. ત્યારે રાજકીય પક્ષના નેતાઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

દરમિયાન, કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો માહોલ હવે ધીરે-ધીરે જામી રહ્યો છે. ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયા બાદ રાજકીય પક્ષો પ્રચારમાં પ્રવૃત્ત બન્યા છે, ત્યારે જિલ્લામાં સત્તાધારી પક્ષ ભાજપે ચૂંટણી પહેલા જ 26 બેઠક બિનહરીફ મેળવી છે. વર્ષ 200૫ બાદ આ વખતે જિલ્લામાં સર્વાધિક બેઠકો બિનહરીફ થઈ છે.

2005ની વાત કરીએ તો, એ વખતે મુંદરા તાલુકા પંચાયતમાં ભાજપે 12 બેઠક બિનહરીફ મેળવી ચૂંટણીના ધમધમાટ પૂર્વે જ તાલુકા પંચાયતમાં સત્તા કબજે કરી હતી. એ વખતે સમગ્ર કચ્છના સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જંગમાં ભાજપે 34 અને કોંગ્રેસે બે બેઠક બિનહરીફ મેળવતાં 36 બેઠક બિનહરીફ થયાનો વિક્રમ સર્જાયો હતો.

ત્યારબાદ 2010માં 6, 2021માં 10, 2015 માં માત્ર ત્રણ બેઠક બિનહરીફ થઈ હતી. આ વખતની ચૂંટણીની વાત કરીએ તો, મહાનગરપાલિકા અને જિ. પંચાયતમાં એક-એક, નગરપાલિકામાં 15 અને તાલુકા પંચાયતમાં નવ મળી 26 બેઠક બિનહરીફ થઈ છે.

શિક્ષકોની ભરતી :

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં સરકારી શાળાઓમાં ધોરણ 1થી 5 માટે 11,000 જેટલા વિદ્યાસહાયકોની જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી હતી.

જે અંતર્ગત ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ હવે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ ખાતે રૂબરૂમાં ફોર્મની ખરાઈ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ડાયટ ખાતે આગામી ૨૫ એપ્રિલ સુધી ખાસ સ્વીકાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી 113 જેટલા ઉમેદવારોએ ભરતીમાં સામેલ થવા માટે ઓનલાઈન ફોર્મ ભરીને પોતાના ઓરીજનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરાવી છે.

આ ભરતીના પગલે જિલ્લામાં લાંબા સમયથી વર્તાઈ રહેલી શિક્ષકોની અછત દૂર થવાની આશા સેવાઈ રહી છે. હાલ કચ્છમાં ધોરણ 1 થી 5 માં અંદાજે 1400 જેટલા શિક્ષકોની ઘટ હોવાના કારણે પ્રાથમિક શિક્ષણ પર અસર પડી રહી છે.

વિશ્વ ધરોહર દિવસ :

આજે વિશ્વ ધરોહર દિવસ ઉજવાઈ રહ્યો છે. ઐતિહાસિક સ્થળોના રક્ષણ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 18 એપ્રિલે આદિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીમાં સ્મારકોની મુલાકાત, પરિષદો, શૈક્ષણિક કાર્યક્રમો અને ફોટો પ્રદર્શનોનો સમાવેશ થાય છે.

વૈશ્વિક કક્ષાએ યુનેસ્કો દ્વારા વિવિધ વિષય વસ્તુ આધારિત જાહેર કરવામાં આવેલા 'વિશ્વ વિરાસત સ્થળો' દેશ-વિદેશના પ્રવાસીઓ અને સંશોધકો માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. ગુજરાતમાં પણ સ્થાપત્ય, ઇતિહાસ, જળ વ્યવસ્થાપન, કલા, શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને યુનેસ્કો દ્વારા ચાંપાનેર, રાણીકી વાવ, અમદાવાદ શહેર અને ધોળાવીરા એમ ચાર સાઈટને વર્લ્ડ હેરિટેજ-વિશ્વ વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યાં દર વર્ષે દેશ વિદેશના લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે.

ગરમીથી બચવાના ઉપાયો :

ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો ઉંચો જતા જનજીવન પર પ્રભાવ પડવાનું શરૂ થયું છે. વધતા જતાતાપમાન અને 'લૂ' લાગવાના ભયને જોતા લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અને સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવા તબીબોએ સલાહ આપી છે.

ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવું સૌથી મહત્વનું છે. તરસ ન લાગે તો પણ નિયમિત સમયાંતરે પૂરતું પાણી પીવું જોઈએ. આ ઉપરાંત ઓ.આર.એસ, તાજી લસી, લીંબુ પાણી, છાશ, નાળિયેર પાણી અને ખાંડ-મીઠાનું દ્રાવણ લેવું હિતાવહ છે. ગરમીમાં હળવા રંગના, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવાની સલાહ પણ આપવામાં આવી છે.

ખાસ કરીને વૃદ્ધો, બાળકો, સગર્ભા મહિલાઓ અને વધુ વજન ધરાવતી વ્યક્તિઓએ આ ગરમીમાં વિશેષ કાળજી લેવાની જરૂર હોય છે.

જો કોઈ વ્યક્તિને માથામાં કે પગની પિંડીઓમાં દુખાવો, શરીરનું તાપમાન વધી જવું, અતિશય તરસ લાગવી, ઉલટી-ઉબકા, ચક્કર આવવા કે મૂઝવણ થવી જેવા લક્ષણો જણાય, તો તે લૂ ના સંકેત હોઈ શકે છે. આવા કિસ્સામાં તાત્કાલિક પ્રાથમિક સારવાર લઈ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે.

દરમ્યાન, ગાંધીધામ અને કંડલા સંકુલમાં ગરમીના વધતા પ્રમાણને જોતા દીન દયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સખત તાપમાં મજૂરી કામ કરતા શ્રમિકો માટે બપોરે આરામ આપવાની સાથે ઠંડી છાશનું વિતરણ તેમજ ગરમીમાં લૂ થી બચવાની ખાસ કિટનું વિતરણ જેવા કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
